

રાજકોટ મહાનગરપાલિકા

ડૉ. આંબેડકર લવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી:-

ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે ક્વોલીટી કંટ્રોલ સેલ માટે નવી બની રહેલ અદ્યતન લેબોરેટરી અને જયુબેલી ખાતેના વર્ષો જુના ESRનું સ્ટ્રેન્ધનીંગ (મજબુતીકરણ)ની ચાલુ કામગીરીની સમીક્ષા મુલાકાત કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા

ક્વોલીટી કંટ્રોલ સેલ માટેની અદ્યતન લેબોરેટરી માટે જરૂરી તાંત્રિક મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટ તાત્કાલિક ખરીદ કરવા માટે સંબંધિત અધિકારીને સુચના

આ અદ્યતન લેબોરેટરી કાર્યરત થયે સિવિલ કામોમાં વપરાતા મટીરીયલ્સનું ટેસ્ટીંગ જેમકે, સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી, કપચી, ડામર વિગેરેનું ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ થશે

તારીખ: ૧૦-૦૫-૨૦૨૨

રાજકોટ શહેરમાં ચાલતા સિવિલ કામોના સેમ્પલીંગ લઈ તેનું લેબોરેટરી ટેસ્ટીંગ કરી વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરી શકાય તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે ક્વોલીટી કંટ્રોલ સેલ માટે નવી અદ્યતન લેબોરેટરી બનાવવામાં આવી રહી છે તેમજ જયુબેલી ખાતેના વર્ષો જુના ESRનું સ્ટ્રેન્ધનીંગ (મજબુતીકરણ) કરવાની કામગીરી પણ હાલ ચાલુ છે. બંને પ્રોજેક્ટની કામગીરી પૂર્ણતાના આરે છે. મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ તા. ૦૯-૦૫-૨૦૨૨ના રોજ બંને ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી.

વધુમાં મ્યુનિ. કમિશનરશ્રીએ ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે ક્વોલીટી કંટ્રોલ સેલ માટે નવી બનાવવામાં આવી રહેલી અદ્યતન લેબોરેટરી માટે જરૂરી તાંત્રિક મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટ તાત્કાલિક ખરીદ કરવા માટે સંબંધિત અધિકારીને સુચના આપી હતી. ક્વોલીટી કંટ્રોલ સેલ માટેની આ નવી અદ્યતન લેબોરેટરી અંદાજિત રૂ. ૭૫ લાખના ખર્ચે બનાવવામાં આવી રહી છે જેમાં અંદાજિત ૪૦૦ ચો.મી. બાંધકામ કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે વિજીલન્સ વિભાગની કામગીરી માટે લેબોરેટરી બનાવવામાં આવી રહી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ચાલુ તમામ સિવિલ કામોમાં વપરાતા મટીરીયલ્સનું ટેસ્ટીંગ જેમકે,

સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી, કપચી, ડામર વિગેરેનું ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ થશે. ભવિષ્યમાં NABL સર્ટિફિકેટ મેળવી રાજકોટ શહેરના અન્ય પ્રાઇવેટ સિવિલ પ્રોજેક્ટના મટીરીયલ્સ ટેસ્ટીંગ કરવાની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

જયુબેલી પમ્પીંગ સ્ટેશન ખાતે આવેલા ESR કે જે આશરે ૩૨ વર્ષ પહેલાનું બાંધકામ છે. આ ESR કન્ટેઇનરનું વોટર પુફીંગ કામ હાલ ચાલુ છે અને પૂર્ણતાના આરે છે જેનું અંદાજિત ખર્ચ રૂ. ૬૪ લાખ છે. બંને ESRની ૫.૪ MLની કેપેસિટી ધરાવે છે. જેમાં એપોક્ષી ગ્રાઉન્ટીંગ, માઈક્રો કોંક્રીટ, મોડીફાઈડ મોટરથી જરૂરી પેચવર્ક, તળિયાનું IPS તેમજ સમગ્ર સપાટી ઉપર કુડ ગ્રેડ પ્રકારનું વોટર પુફીંગ લેવલ કરવામાં આવેલ છે. આ કામગીરી કરવાથી ESRની મજબુતીમાં વધારો થયેલ છે.

આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી, સિટી એન્જી. શ્રી કે. પી. દેથરીયા, શ્રી એચ. એમ. કોટક, પી.એ.(ટેક.)ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, ડી.ઈ.ઈ. શ્રી ગોપાલ સુથરીયા વિગેરે અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(જન સંપર્ક અધિકારી)
રાજકોટ મહાનગરપાલિકા